

—ן—בְּרִבְעָה, הַיּוֹם וְלֹא בְּתְּרִבְעָה 1

\* \* \* \*

25 የሚደረግ በፌዴራል አስተያየት ስምምነት ይፈጸመ ይችላል 26 የሚደረግ በፌዴራል አስተያየት ስምምነት ይፈጸመ ይችላል 27 የሚደረግ በፌዴራል አስተያየት ስምምነት ይፈጸመ ይችላል 28 የሚደረግ በፌዴራል አስተያየት ስምምነት ይፈጸመ ይችላል 29 የሚደረግ በፌዴራል አስተያየት ስምምነት ይፈጸመ ይችላል 30 የሚደረግ በፌዴራል አስተያየት ስምምነት ይፈጸመ ይችላል 31 የሚደረግ በፌዴራል አስተያየት ስምምነት ይፈጸመ ይችላል 32 የሚደረግ በፌዴራል አስተያየት ስምምነት ይፈጸመ ይችላል 33 የሚደረግ በፌዴራል አስተያየት ስምምነት ይፈጸመ ይችላል 34 የሚደረግ በፌዴራል አስተያየት ስምምነት ይፈጸመ ይችላል 35 የሚደረግ በፌዴራል አስተያየት ስምምነት ይፈጸመ ይችላል 36 የሚደረግ በፌዴራል አስተያየት ስምምነት ይፈጸመ ይችላል

1. תְּבִיבָה לְבִבְבָּה וְבַבְבָּה וְבַבְבָּה  
 2. לְבִבְבָּה וְבַבְבָּה וְבַבְבָּה וְבַבְבָּה  
 3. וְבַבְבָּה וְבַבְבָּה וְבַבְבָּה וְבַבְבָּה  
 4. וְבַבְבָּה וְבַבְבָּה וְבַבְבָּה וְבַבְבָּה  
 5. וְבַבְבָּה וְבַבְבָּה וְבַבְבָּה וְבַבְבָּה  
 6. וְבַבְבָּה וְבַבְבָּה וְבַבְבָּה וְבַבְבָּה  
 7. וְבַבְבָּה וְבַבְבָּה וְבַבְבָּה וְבַבְבָּה  
 8. וְבַבְבָּה וְבַבְבָּה וְבַבְבָּה וְבַבְבָּה  
 9. וְבַבְבָּה וְבַבְבָּה וְבַבְבָּה וְבַבְבָּה  
 10. וְבַבְבָּה וְבַבְבָּה וְבַבְבָּה וְבַבְבָּה  
 11. וְבַבְבָּה וְבַבְבָּה וְבַבְבָּה וְבַבְבָּה  
 12. וְבַבְבָּה וְבַבְבָּה וְבַבְבָּה וְבַבְבָּה  
 13. וְבַבְבָּה וְבַבְבָּה וְבַבְבָּה וְבַבְבָּה  
 14. וְבַבְבָּה וְבַבְבָּה וְבַבְבָּה וְבַבְבָּה

1 לְפָנֶיךָ יְהוָה אֱלֹהֵינוּ וְאֶת־בְּנֵינוּ כִּי־אַתָּה  
2 כִּי־אַתָּה קָדוֹשׁ בָּרוּךְ הוּא וְאַתָּה קָדוֹשׁ  
3 כִּי־אַתָּה קָדוֹשׁ בָּרוּךְ הוּא וְאַתָּה קָדוֹשׁ





4

1 לְפָנֶיךָ תִּשְׁאַל וְאֵלֶיךָ תִּשְׁאַל כִּי  
2 מִשְׁמָרָתְךָ תִּשְׁאַל וְאֵלֶיךָ תִּשְׁאַל כִּי  
3 מִשְׁמָרָתְךָ תִּשְׁאַל וְאֵלֶיךָ תִּשְׁאַל כִּי  
4 מִשְׁמָרָתְךָ תִּשְׁאַל וְאֵלֶיךָ תִּשְׁאַל כִּי  
5 מִשְׁמָרָתְךָ תִּשְׁאַל וְאֵלֶיךָ תִּשְׁאַל כִּי  
6 מִשְׁמָרָתְךָ תִּשְׁאַל וְאֵלֶיךָ תִּשְׁאַל כִּי  
7 מִשְׁמָרָתְךָ תִּשְׁאַל וְאֵלֶיךָ תִּשְׁאַל כִּי  
8 מִשְׁמָרָתְךָ תִּשְׁאַל וְאֵלֶיךָ תִּשְׁאַל כִּי  
9 מִשְׁמָרָתְךָ תִּשְׁאַל וְאֵלֶיךָ תִּשְׁאַל כִּי



5

12      לְפָנֶיךָ תִּתְהַלֵּךְ וְאַתָּה תִּמְלֹחַ  
13     וְאַתָּה תִּשְׁבַּח בְּכָל-עֲמָדָה  
14     וְאַתָּה תִּשְׁבַּח בְּכָל-עֲמָדָה  
15     וְאַתָּה תִּשְׁבַּח בְּכָל-עֲמָדָה  
16     וְאַתָּה תִּשְׁבַּח בְּכָל-עֲמָדָה  
17     וְאַתָּה תִּשְׁבַּח בְּכָל-עֲמָדָה  
18     וְאַתָּה תִּשְׁבַּח בְּכָל-עֲמָדָה  
19     וְאַתָּה תִּשְׁבַּח בְּכָל-עֲמָדָה  
20     וְאַתָּה תִּשְׁבַּח בְּכָל-עֲמָדָה  
21     וְאַתָּה תִּשְׁבַּח בְּכָל-עֲמָדָה  
22     וְאַתָּה תִּשְׁבַּח בְּכָל-עֲמָדָה  
23     וְאַתָּה תִּשְׁבַּח בְּכָל-עֲמָדָה  
24     וְאַתָּה תִּשְׁבַּח בְּכָל-עֲמָדָה  
25     וְאַתָּה תִּשְׁבַּח בְּכָל-עֲמָדָה  
26     וְאַתָּה תִּשְׁבַּח בְּכָל-עֲמָדָה  
27     וְאַתָּה תִּשְׁבַּח בְּכָל-עֲמָדָה

6

9 אָמַרְתִּי וְעַל־בְּנֵי־יִשְׂרָאֵל תְּהִלָּתְךָ כְּבָדָלָה  
10 תְּהִלָּתְךָ כְּבָדָלָה תְּהִלָּתְךָ כְּבָדָלָה  
11 תְּהִלָּתְךָ כְּבָדָלָה תְּהִלָּתְךָ כְּבָדָלָה  
12 תְּהִלָּתְךָ כְּבָדָלָה תְּהִלָּתְךָ כְּבָדָלָה  
13 תְּהִלָּתְךָ כְּבָדָלָה תְּהִלָּתְךָ כְּבָדָלָה  
14 תְּהִלָּתְךָ כְּבָדָלָה תְּהִלָּתְךָ כְּבָדָלָה  
15 תְּהִלָּתְךָ כְּבָדָלָה תְּהִלָּתְךָ כְּבָדָלָה  
16 תְּהִלָּתְךָ כְּבָדָלָה תְּהִלָּתְךָ כְּבָדָלָה  
17 תְּהִלָּתְךָ כְּבָדָלָה תְּהִלָּתְךָ כְּבָדָלָה  
18 תְּהִלָּתְךָ כְּבָדָלָה תְּהִלָּתְךָ כְּבָדָלָה  
19 תְּהִלָּתְךָ כְּבָדָלָה תְּהִלָּתְךָ כְּבָדָלָה  
20 תְּהִלָּתְךָ כְּבָדָלָה תְּהִלָּתְךָ כְּבָדָלָה

אֲזִתְבָּב לְפָנֶיךָ תְּנַשֵּׁא כֹּחַ, וְאַתָּה אַתָּה בְּמִזְרָחַ  
אֲזִתְבָּב לְפָנֶיךָ תְּנַשֵּׁא כֹּחַ, וְאַתָּה אַתָּה בְּמִזְרָחַ  
לְמִזְרָחַ 21, תְּנַשֵּׁא כֹּחַ, וְאַתָּה אַתָּה בְּמִזְרָחַ  
תְּנַשֵּׁא כֹּחַ, וְאַתָּה אַתָּה בְּמִזְרָחַ 22, תְּנַשֵּׁא כֹּחַ, וְאַתָּה אַתָּה  
וְאַתָּה בְּמִזְרָחַ 23, תְּנַשֵּׁא כֹּחַ, וְאַתָּה אַתָּה בְּמִזְרָחַ  
אֲזִתְבָּב לְפָנֶיךָ תְּנַשֵּׁא כֹּחַ, וְאַתָּה אַתָּה בְּמִזְרָחַ 24, תְּנַשֵּׁא כֹּחַ, וְאַתָּה אַתָּה  
בְּמִזְרָחַ, תְּנַשֵּׁא כֹּחַ, וְאַתָּה אַתָּה בְּמִזְרָחַ 25, תְּנַשֵּׁא כֹּחַ, וְאַתָּה אַתָּה  
וְאַתָּה בְּמִזְרָחַ 26, תְּנַשֵּׁא כֹּחַ, וְאַתָּה אַתָּה בְּמִזְרָחַ  
וְאַתָּה בְּמִזְרָחַ 27, תְּנַשֵּׁא כֹּחַ, וְאַתָּה אַתָּה  
וְאַתָּה בְּמִזְרָחַ 28, תְּנַשֵּׁא כֹּחַ, וְאַתָּה אַתָּה  
וְאַתָּה בְּמִזְרָחַ 29, תְּנַשֵּׁא כֹּחַ, וְאַתָּה אַתָּה  
וְאַתָּה בְּמִזְרָחַ 30, תְּנַשֵּׁא כֹּחַ, וְאַתָּה אַתָּה  
וְאַתָּה בְּמִזְרָחַ 31, תְּנַשֵּׁא כֹּחַ, וְאַתָּה אַתָּה  
וְאַתָּה בְּמִזְרָחַ 32, תְּנַשֵּׁא כֹּחַ, וְאַתָּה אַתָּה



4 የጤና ተቋቃዎች ስለዚህ አንቀጽ ተቋቃዎች ስለዚህ አንቀጽ  
5 ተቋቃዎች ስለዚህ አንቀጽ ተቋቃዎች ስለዚህ አንቀጽ  
6 ተቋቃዎች ስለዚህ አንቀጽ ተቋቃዎች ስለዚህ አንቀጽ  
7 ተቋቃዎች ስለዚህ አንቀጽ ተቋቃዎች ስለዚህ አንቀጽ  
8 ተቋቃዎች ስለዚህ አንቀጽ ተቋቃዎች ስለዚህ አንቀጽ  
9 ተቋቃዎች ስለዚህ አንቀጽ ተቋቃዎች ስለዚህ አንቀጽ  
10 ተቋቃዎች ስለዚህ አንቀጽ ተቋቃዎች ስለዚህ አንቀጽ  
11 ተቋቃዎች ስለዚህ አንቀጽ ተቋቃዎች ስለዚህ አንቀጽ  
12 ተቋቃዎች ስለዚህ አንቀጽ ተቋቃዎች ስለዚህ አንቀጽ  
13 ተቋቃዎች ስለዚህ አንቀጽ ተቋቃዎች ስለዚህ አንቀጽ



לְדֹבֶר כָּתַב מִקְרָא בְּפִילָגָה וְזֶה לְפָנֵי יְהוָה 25



1 የሚገኘው በመሆኑ ስራውን እንደሚከተሉ ተስፋይ ተስፋይ የሚከተሉበት ተስፋይ የሚከተሉበት ተስፋይ









גָּדְעָן

10



בְּמִזְבֵּחַ בְּמִזְבֵּחַ, וְיָדָיו מִזְבֵּחַ וְלִבְנָה לְמִזְבֵּחַ תַּלְמִידָה  
וְלִבְנָה, וְלִבְנָה אֶת אֶתְמָרָה לְמִזְבֵּחַ 6 אֶתְמָרָה אֶתְמָרָה  
וְלִבְנָה, וְלִבְנָה אֶת אֶתְמָרָה 7 לְמִזְבֵּחַ בְּמִזְבֵּחַ  
וְלִבְנָה אֶת אֶתְמָרָה, וְלִבְנָה אֶת אֶתְמָרָה  
וְלִבְנָה אֶת אֶתְמָרָה 8 לְמִזְבֵּחַ לְמִזְבֵּחַ, וְלִבְנָה אֶת אֶתְמָרָה  
וְלִבְנָה לְמִזְבֵּחַ וְלִבְנָה אֶת אֶתְמָרָה 9 לְמִזְבֵּחַ בְּמִזְבֵּחַ  
וְלִבְנָה אֶת אֶתְמָרָה, וְלִבְנָה אֶת אֶתְמָרָה  
וְלִבְנָה, וְלִבְנָה אֶת אֶתְמָרָה 10 לְמִזְבֵּחַ  
וְלִבְנָה, וְלִבְנָה אֶת אֶתְמָרָה 11 לְמִזְבֵּחַ, וְלִבְנָה אֶת אֶתְמָרָה  
וְלִבְנָה, וְלִבְנָה אֶת אֶתְמָרָה 12 אֶת אֶתְמָרָה, וְלִבְנָה אֶת אֶתְמָרָה  
וְלִבְנָה, וְלִבְנָה אֶת אֶתְמָרָה 13 לְמִזְבֵּחַ, וְלִבְנָה אֶת אֶתְמָרָה  
וְלִבְנָה, וְלִבְנָה אֶת אֶתְמָרָה 14 לְמִזְבֵּחַ, וְלִבְנָה אֶת אֶתְמָרָה  
וְלִבְנָה, וְלִבְנָה אֶת אֶתְמָרָה 15 לְמִזְבֵּחַ, וְלִבְנָה אֶת אֶתְמָרָה  
וְלִבְנָה, וְלִבְנָה אֶת אֶתְמָרָה 16 לְמִזְבֵּחַ, וְלִבְנָה אֶת אֶתְמָרָה  
וְלִבְנָה, וְלִבְנָה אֶת אֶתְמָרָה 17 אֶת אֶתְמָרָה, וְלִבְנָה אֶת אֶתְמָרָה  
וְלִבְנָה, וְלִבְנָה אֶת אֶתְמָרָה



30 የመ፡፡ ተጠቃሚ ነው ስለዚ ጥሩ ተጠቃሚ ነው ስለዚ ጥሩ  
የሁኔታ የተስተካከለ ሲሆን ተጠቃሚ ነው ስለዚ ጥሩ 31  
የሁኔታ የተስተካከለ ሲሆን ተጠቃሚ ነው ስለዚ ጥሩ  
የሁኔታ የተስተካከለ ሲሆን ተጠቃሚ ነው ስለዚ ጥሩ 32  
የሁኔታ የተስተካከለ ሲሆን ተጠቃሚ ነው ስለዚ ጥሩ  
የሁኔታ የተስተካከለ ሲሆን ተጠቃሚ ነው ስለዚ ጥሩ 33  
የሁኔታ የተስተካከለ ሲሆን ተጠቃሚ ነው ስለዚ ጥሩ  
የሁኔታ የተስተካከለ ሲሆን ተጠቃሚ ነው ስለዚ ጥሩ 34  
የሁኔታ የተስተካከለ ሲሆን ተጠቃሚ ነው ስለዚ ጥሩ  
የሁኔታ የተስተካከለ ሲሆን ተጠቃሚ ነው ስለዚ ጥሩ 35  
የሁኔታ የተስተካከለ ሲሆን ተጠቃሚ ነው ስለዚ ጥሩ  
የሁኔታ የተስተካከለ ሲሆን ተጠቃሚ ነው ስለዚ ጥሩ 36  
የሁኔታ የተስተካከለ ሲሆን ተጠቃሚ ነው ስለዚ ጥሩ  
የሁኔታ የተስተካከለ ሲሆን ተጠቃሚ ነው ስለዚ ጥሩ 37  
የሁኔታ የተስተካከለ ሲሆን ተጠቃሚ ነው ስለዚ ጥሩ  
የሁኔታ የተስተካከለ ሲሆን ተጠቃሚ ነው ስለዚ ጥሩ 38  
የሁኔታ የተስተካከለ ሲሆን ተጠቃሚ ነው ስለዚ ጥሩ  
የሁኔታ የተስተካከለ ሲሆን ተጠቃሚ ነው ስለዚ ጥሩ 39  
የሁኔታ የተስተካከለ ሲሆን ተጠቃሚ ነው ስለዚ ጥሩ  
የሁኔታ የተስተካከለ ሲሆን ተጠቃሚ ነው ስለዚ ጥሩ 40  
የሁኔታ የተስተካከለ ሲሆን ተጠቃሚ ነው ስለዚ ጥሩ  
የሁኔታ የተስተካከለ ሲሆን ተጠቃሚ ነው ስለዚ ጥሩ

የመሬት ማኅበ በኋላ እና የመሬት ማኅበ በኋላ 1  
 የመሬት ማኅበ በኋላ እና የመሬት ማኅበ በኋላ  
 የመሬት ማኅበ በኋላ እና የመሬት ማኅበ 2  
 የመሬት ማኅበ በኋላ እና የመሬት ማኅበ 3  
 የመሬት ማኅበ በኋላ እና የመሬት ማኅበ 4  
 የመሬት ማኅበ በኋላ እና የመሬት ማኅበ 5  
 የመሬት ማኅበ በኋላ እና የመሬት ማኅበ 6  
 የመሬት ማኅበ በኋላ እና የመሬት ማኅበ 7  
 የመሬት ማኅበ በኋላ እና የመሬት ማኅበ 8  
 የመሬት ማኅበ በኋላ እና የመሬት ማኅበ 9  
 የመሬት ማኅበ በኋላ እና የመሬት ማኅበ 10  
 የመሬት ማኅበ በኋላ እና የመሬት ማኅበ 11  
 የመሬት ማኅበ በኋላ እና የመሬት ማኅበ 12  
 የመሬት ማኅበ በኋላ እና የመሬት ማኅበ 13  
 የመሬት ማኅበ በኋላ እና የመሬት ማኅበ 14  
 የመሬት ማኅበ በኋላ እና የመሬት ማኅበ 15



11, አስተዳደር የመጀመሪያ ስርዓት, በመጀመሪያ የመጀመሪያ  
አስተዳደር የመጀመሪያ ስርዓት በመጀመሪያ የመጀመሪያ ስርዓት  
የመጀመሪያ ስርዓት በመጀመሪያ ስርዓት 12 የመጀመሪያ የመጀመሪያ  
የመጀመሪያ 13, በመጀመሪያ ስርዓት በመጀመሪያ ስርዓት  
የመጀመሪያ ስርዓት በመጀመሪያ ስርዓት በመጀመሪያ ስርዓት  
የመጀመሪያ ስርዓት 14 በመጀመሪያ ስርዓት በመጀመሪያ  
የመጀመሪያ ስርዓት 15 በመጀመሪያ ስርዓት በመጀመሪያ  
የመጀመሪያ ስርዓት 16 በመጀመሪያ ስርዓት  
የመጀመሪያ ስርዓት 17 በመጀመሪያ ስርዓት  
የመጀመሪያ ስርዓት 18 በመጀመሪያ ስርዓት  
የመጀመሪያ ስርዓት 19 በመጀመሪያ ስርዓት  
የመጀመሪያ ስርዓት 20 በመጀመሪያ ስርዓት  
የመጀመሪያ ስርዓት 21 በመጀመሪያ  
የመጀመሪያ 22 በመጀመሪያ  
የመጀመሪያ 23 በመጀመሪያ  
የመጀመሪያ 24 የመጀመሪያ

ל

14

1  
2  
3  
4  
5  
6  
7  
8  
9  
10  
11

12 የመጀመሪያ ተቻል አስተዋዣ  
13 የመጀመሪያ ተቻል አስተዋዣ  
14 የመጀመሪያ ተቻል አስተዋዣ  
15 የመጀመሪያ ተቻል አስተዋዣ  
16 የመጀመሪያ ተቻል አስተዋዣ  
17 የመጀመሪያ ተቻል አስተዋዣ  
18 የመጀመሪያ ተቻል አስተዋዣ  
19 የመጀመሪያ ተቻል አስተዋዣ  
20 የመጀመሪያ ተቻል አስተዋዣ

፡፡፡ የመጀመሪያ ተቻል አስተዋዣ



正

ለኩስ ተደርጓል, የዕቅድ ስራ አገልግሎት ተመርምሮ ተደርጓል 1  
 ተመርምሮ ተደርጓል, የዕቅድ ስራ አገልግሎት ተመርምሮ ተደርጓል 2  
 ተመርምሮ ተደርጓል, የዕቅድ ስራ አገልግሎት ተመርምሮ ተደርጓል 3

የትኩስ የገዢዎች ተኩስ ከሠራው ስ,ፕ,ግ ተቋጥል ሲ,ፕ,ግ  
ማያደር ቅዱስና ተኩስ ተቋጥል ,መጠቅም ስምኑ ተቋጥል ምክንያ  
የተከተለ ዘመኑ ተኩስና 4 ዓይነት የገዢዎች የተከተለ ተኩስና  
የ,አጠቃላይ የ,በኩስና ተኩስና ተቋጥል 5 ስ,ፕ,ግ ተቋጥል መድረግ  
የተከተለ ዘመኑ ተኩስና ተቋጥል ስ,ይ,ወ,መ,መ,ፕ,ግ ተኩስና  
በኩስና ተኩስና ተቋጥል ,መጠቅም ስምኑ ተቋጥል ምክንያ  
የ,አጠቃላይ ዘመኑ ተኩስና 6 የዋጭና የገዢዎች ተቋጥል ተኩስና  
የተከተለ ዘመኑ ተኩስና ተቋጥል ምክንያ ተኩስና 7  
የ,አጠቃላይ ዘመኑ ተኩስና ተቋጥል ምክንያ ተኩስና ተቋጥል  
ለተኩስና ስ,ፕ,ግ ተኩስና ተቋጥል 8  
ቴ,ኩስና ተኩስና ተቋጥል ምክንያ 9 ሌጉ ቅዱስና  
የ,አጠቃላይ ዘመኑ ተኩስና ምክንያ ተኩስና ተቋጥል  
የ,አጠቃላይ ዘመኑ ተኩስና ተቋጥል ምክንያ ተኩስና ተቋጥል  
የ,አጠቃላይ ዘመኑ ተኩስና ተቋጥል 10 ስ,ይ,ወ,መ  
የ,አጠቃላይ ዘመኑ 11 ዘመኑ ተኩስና ተቋጥል ምክንያ  
የ,አጠቃላይ ዘመኑ ተኩስና ተቋጥል ,መ,ማ,ሪ,ማ,ሪ  
የ,አጠቃላይ ዘመኑ 12 ዓይነት ዘመኑ ተኩስና ተቋጥል  
የ,አጠቃላይ ዘመኑ ተኩስና ተቋጥል 13 ዘመኑ ምክንያ  
የ,አጠቃላይ ዘመኑ ተኩስና ተቋጥል ,መ,ማ,ሪ,ማ,ሪ  
የ,አጠቃላይ 14 ዘመኑ ,መ,ማ,ሪ,ማ,ሪ ,መ,ማ,ሪ  
የ,አጠቃላይ ዘመኑ ተኩስና ምክንያ ተኩስና ተቋጥል ምክንያ





רְאֵתָנוּ, וְנִמְלַאֲתָנוּ בְּבָרְכָהָךְ, וְנִשְׁתַּחַדְתָּנוּ בְּבָרְכָהָךְ  
בְּבָרְכָהָךְ, וְנִמְלַאֲתָנוּ בְּבָרְכָהָךְ 6 כְּפָנֶיךָ, וְנִשְׁתַּחַדְתָּנוּ  
בְּבָרְכָהָךְ, וְנִמְלַאֲתָנוּ בְּבָרְכָהָךְ 7 וְנִשְׁתַּחַדְתָּנוּ בְּבָרְכָהָךְ,  
וְנִמְלַאֲתָנוּ בְּבָרְכָהָךְ 8 וְנִשְׁתַּחַדְתָּנוּ בְּבָרְכָהָךְ, וְנִמְלַאֲתָנוּ  
בְּבָרְכָהָךְ, וְנִשְׁתַּחַדְתָּנוּ בְּבָרְכָהָךְ 9 וְנִשְׁתַּחַדְתָּנוּ בְּבָרְכָהָךְ,  
וְנִמְלַאֲתָנוּ בְּבָרְכָהָךְ, וְנִשְׁתַּחַדְתָּנוּ בְּבָרְכָהָךְ 10 וְנִשְׁתַּחַדְתָּנוּ  
בְּבָרְכָהָךְ, וְנִמְלַאֲתָנוּ בְּבָרְכָהָךְ, וְנִשְׁתַּחַדְתָּנוּ בְּבָרְכָהָךְ  
בְּבָרְכָהָךְ, וְנִמְלַאֲתָנוּ בְּבָרְכָהָךְ, וְנִשְׁתַּחַדְתָּנוּ בְּבָרְכָהָךְ 11  
בְּבָרְכָהָךְ, וְנִמְלַאֲתָנוּ בְּבָרְכָהָךְ, וְנִשְׁתַּחַדְתָּנוּ בְּבָרְכָהָךְ 12, וְנִמְלַאֲתָנוּ  
בְּבָרְכָהָךְ, וְנִשְׁתַּחַדְתָּנוּ בְּבָרְכָהָךְ 13 וְנִשְׁתַּחַדְתָּנוּ בְּבָרְכָהָךְ, וְנִמְלַאֲתָנוּ



לענין במלון, מזבח טהורה במלון הוא מטה  
ולענין במלון מטבח אכזרי ו... 17  
ו- 18 מטבח אכזרי מטבח אכזרי מטבח אכזרי  
ו- 19 מטבח אכזרי מטבח אכזרי מטבח אכזרי  
ו- 20 מטבח אכזרי מטבח אכזרי מטבח אכזרי  
ו- 21 מטבח אכזרי מטבח אכזרי מטבח אכזרי  
ו- 22 מטבח אכזרי מטבח אכזרי מטבח אכזרי  
ו- 23 מטבח אכזרי מטבח אכזרי מטבח אכזרי  
ו- 24 מטבח אכזרי מטבח אכזרי מטבח אכזרי  
ו- 25 מטבח אכזרי מטבח אכזרי מטבח אכזרי  
ו- 26 מטבח אכזרי מטבח אכזרי מטבח אכזרי  
ו- 27 מטבח אכזרי מטבח אכזרי מטבח אכזרי  
ו- 28 מטבח אכזרי מטבח אכזרי מטבח אכזרי

בְּדִין מִתְּמָדָה כַּא כְּשֶׁלְּבָדְקָה, וְכֵן כְּשֶׁלְּבָדְקָה  
בְּדִין מִתְּמָדָה כַּא כְּשֶׁלְּבָדְקָה, וְכֵן כְּשֶׁלְּבָדְקָה 29  
בְּדִין מִתְּמָדָה כַּא כְּשֶׁלְּבָדְקָה, וְכֵן כְּשֶׁלְּבָדְקָה 30  
בְּדִין מִתְּמָדָה כַּא כְּשֶׁלְּבָדְקָה, וְכֵן כְּשֶׁלְּבָדְקָה 31

19



טַלְלָה

የአክሱኑን ስራይነዱ በ, የ, እና መጠየቅ ስምዎች 1  
 የደንብ ማስተካከል ተመርሱ ይሆናል ይህንን የአክሱኑን  
 የሚገኘው መግለጫ ሲሆን የ, የ, የሚገኘው መግለጫ 2  
 የአክሱኑን መግለጫ ሲሆን የ, የ, የሚገኘው መግለጫ  
 የአክሱኑን መግለጫ ሲሆን የ, የ, የሚገኘው መግለጫ  
 የአክሱኑን መግለጫ ሲሆን የ, የ, የሚገኘው መግለጫ 3  
 የአክሱኑን መግለጫ ሲሆን የ, የ, የሚገኘው መግለጫ  
 የአክሱኑን መግለጫ ሲሆን የ, የ, የሚገኘው መግለጫ  
 የአክሱኑን መግለጫ ሲሆን የ, የ, የሚገኘው መግለጫ 4  
 የአክሱኑን መግለጫ ሲሆን የ, የ, የሚገኘው መግለጫ  
 የአክሱኑን መግለጫ ሲሆን የ, የ, የሚገኘው መግለጫ  
 የአክሱኑን መግለጫ ሲሆን የ, የ, የሚገኘው መግለጫ 5  
 የአክሱኑን መግለጫ ሲሆን የ, የ, የሚገኘው መግለጫ  
 የአክሱኑን መግለጫ ሲሆን የ, የ, የሚገኘው መግለጫ 6  
 የአክሱኑን መግለጫ ሲሆን የ, የ, የሚገኘው መግለጫ  
 የአክሱኑን መግለጫ ሲሆን የ, የ, የሚገኘው መግለጫ 7  
 የአክሱኑን መግለጫ ሲሆን የ, የ, የሚገኘው መግለጫ  
 የአክሱኑን መግለጫ ሲሆን የ, የ, የሚገኘው መግለጫ 8  
 የአክሱኑን መግለጫ ሲሆን የ, የ, የሚገኘው መግለጫ  
 የአክሱኑን መግለጫ ሲሆን የ, የ, የሚገኘው መግለጫ 9  
 የአክሱኑን መግለጫ ሲሆን የ, የ, የሚገኘው መግለጫ 10  
 የአክሱኑን መግለጫ ሲሆን የ, የ, የሚገኘው መግለጫ  
 የአክሱኑን መግለጫ ሲሆን የ, የ, የሚገኘው መግለጫ 11  
 የአክሱኑን መግለጫ ሲሆን የ, የ, የሚገኘው መግለጫ 12  
 የአክሱኑን መግለጫ ሲሆን የ, የ, የሚገኘው መግለጫ 13





וְהַיְלָה אֶת־בְּנֵי־יִשְׂרָאֵל כִּי־יְהוָה אֱלֹהֵינוּ וְאֶת־<sup>37</sup>  
אֶת־שְׁמָנוֹתֵינוּ וְאֶת־מִנְחָתֵינוּ וְאֶת־<sup>38</sup>  
אֶת־מִזְבְּחָתֵינוּ וְאֶת־<sup>39</sup>  
אֶת־מִזְבְּחָתֵינוּ וְאֶת־<sup>40</sup>  
אֶת־מִזְבְּחָתֵינוּ וְאֶת־<sup>41</sup>  
אֶת־מִזְבְּחָתֵינוּ וְאֶת־<sup>42</sup>  
אֶת־מִזְבְּחָתֵינוּ וְאֶת־<sup>43</sup>  
אֶת־מִזְבְּחָתֵינוּ וְאֶת־<sup>44</sup>  
אֶת־מִזְבְּחָתֵינוּ וְאֶת־<sup>45</sup>  
אֶת־מִזְבְּחָתֵינוּ וְאֶת־<sup>46</sup>  
אֶת־מִזְבְּחָתֵינוּ וְאֶת־<sup>47</sup>  
אֶת־מִזְבְּחָתֵינוּ וְאֶת־<sup>48</sup>

ለጊዜ የጊዜ ሥነዎች በኋላ የጊዜ ሥነዎች በኋላ

የተዘጋጀ

21

1 ገዢ የጊዜ ሥነዎች በኋላ የጊዜ ሥነዎች በኋላ  
2 የጊዜ ሥነዎች በኋላ የጊዜ ሥነዎች በኋላ  
3 የጊዜ ሥነዎች በኋላ የጊዜ ሥነዎች በኋላ  
4 የጊዜ ሥነዎች በኋላ የጊዜ ሥነዎች በኋላ  
5 የጊዜ ሥነዎች በኋላ የጊዜ ሥነዎች በኋላ  
6 የጊዜ ሥነዎች በኋላ የጊዜ ሥነዎች በኋላ  
7 የጊዜ ሥነዎች በኋላ የጊዜ ሥነዎች በኋላ  
8 የጊዜ ሥነዎች በኋላ የጊዜ ሥነዎች በኋላ  
9 የጊዜ ሥነዎች በኋላ የጊዜ ሥነዎች በኋላ  
10 የጊዜ ሥነዎች በኋላ የጊዜ ሥነዎች በኋላ  
11 የጊዜ ሥነዎች በኋላ የጊዜ ሥነዎች በኋላ  
12 የጊዜ ሥነዎች በኋላ የጊዜ ሥነዎች በኋላ



ମ,ପ୍ରାଣ ରହିଥିଲା,ଏବଂ 25 ଶତାବ୍ଦୀ,ପ୍ରାଚୀନ କାଳରେ  
ଏଣେ ,ଗଣନାତିକାରୀ,ପ୍ରତିଷ୍ଠାତା ପାଇଁ ପ୍ରତିଷ୍ଠାତା  
ମାତ୍ରାରେ ପାଇଁ ପାଇଁ ପାଇଁ

ରାଜନୀତି